



બી.બી.મોટી
અપીલ અધિકારી અને
ઈ.ચા.મુખ્ય હિસાબનીશ



સુરત મહાનગર સેવાસદન
ગોરધનદાસ ચોખાવાલા માર્ગ,
મુગલીસરા, સુરત – ૩૮૫૦૦૩

આઈ.ડી. નંબર– ૩૧૦૨
કોમ્પ્યુટર અરજી ક્રમાંક નં. ૩૦૦/૪૮૪૩૬
અપીલ અરજી ક્રમાંક: ૨૦૨૪૩૦૦૦૧૦૬

અરજદાર : શ્રી અજીત આર.માલપાણી
સામાવાળા : જાહેર માહિતી અધિકારી અને ડે.એકાઉન્ટન્ટશ્રી, હિસાબી વિભાગ, સુરત મહાનગરપાલિકા

ફરિયાદની હક્કિકત :–

વિષય :-	જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માહિતી આપવા બાબત
સંદર્ભ :-	<p>૧) અરજદારશ્રીની આર.ટી.આઈ. એકટ હેઠળની તા.૨૮/૦૨/૨૦૨૪ ની અરજી આઈ.ડી. નંબર– ૩૧૦૨</p> <p>૨) જાહેર માહિતી અધિકારી અને એક્ઝિક્યુટિવ ઓફિસરશ્રી, નાગરિક સુવિધા કેન્દ્ર, મુગલીસરાના પત્ર નં. સીસીસી.સીઝેડ/આર.ટી.આઈ./આઉટ–૩૧૦૨, તા.૨૮/૦૨/૨૦૨૪ મારફત તબદીલ થઈને આવેલ અરજી અત્રેના હિસાબીખાતા નં. એકા/એસ.આર/ઈન/૧૨૨, તા.૨૮/૦૨/૨૦૨૪ થી હિસાબી ખાતામાં મળેલ છે.</p> <p>૩) અત્રેના પત્ર નં. એકા/આર.ટી.આઈ./૭૭, તા.૧૪/૦૩/૨૦૨૪</p> <p>૪) સેક્શન ઓફિસરશ્રી (ટેક.), ઉધના ઝોન–એ ના પત્ર નં. ૪૦, તા.૦૮/૦૪/૨૦૨૪ રસીદ નં. ૬૦૦/૪૮, રૂ. ૧૦૨/- તા.૦૬/૦૪/૨૦૨૪ ઉધના ઝોન–એ ના સિવિક સેન્ટર ખાતે નાણાં જમા કરાવેલ.</p> <p>૫) અત્રેના પત્ર નં. એકા/આર.ટી.આઈ./૧૦, તા.૧૬/૦૪/૨૦૨૪</p> <p>૬) અરજદારશ્રીની આર.ટી.આઈ. એકટ હેઠળની તા.૦૩/૦૫/૨૦૨૪ ની અપીલ અરજી</p> <p>૭) અપીલ અરજી અત્રેના હિસાબી ખાતા નં. એકા./એસ.આર/ઈન/૧૩, તા.૦૩/૦૫/૨૦૨૪ થી હિસાબી ખાતામાં મળેલ છે.</p> <p>૮) અત્રેના પત્ર નં. એકા/આર.ટી.આઈ./૧૬, તા.૧૫/૦૫/૨૦૨૪</p> <p>૯) અપીલ અરજી બાબતે તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ થયેલ રૂબરૂ સુનાવણી</p>

અરજદારશ્રી અજીત આર.માલપાણી આઈ.ડી.નં. ૩૧૦૨, તા.૦૩/૦૫/૨૦૨૪ ની પ્રથમ અપીલ અરજીથી " Improper reply, Hiding the facts" એવું જણાવી એપેલેટ ઓફિસરશ્રી, હિસાબી વિભાગને તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ પ્રથમ અપીલ કરવામાં આવેલ છે, જે પ્રથમ અપીલ અરજી અત્રેના વિભાગમાં સંદર્ભ–૦૭ થી તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ મળેલ છે.

અરજદારની આઈ.ડી.નં. ૩૧૦૨ તા.૨૮/૦૨/૨૦૨૪ ની અરજીથી માહિતી માંગતી અરજી ઉક્ત સંદર્ભ–૦૨ મુજબના પત્રથી અત્રે હિસાબી વિભાગને તબદીલ કરવામાં આવેલ, જેના અનુસંધાને જાહેર માહિતી અધિકારી અને ડે.એકાઉન્ટન્ટશ્રી તરફથી "સદર અરજી અન્વયે માંગવામાં આવેલ માહિતીના પાના નંગ–૫૧ ના રૂ.૨/- લેખે રૂ. ૧૦૨/-અરજદારશ્રી ધ્વારા જમા કરાવ્યેથી પત્ર નં. એકા/આરટીઆઈ./૧૦, તા.૧૬/૦૪/૨૦૨૪ થી સદર માહિતી પાઠવવામાં આવેલ."

ત્યારબાદ ઉક્ત સંદર્ભ–૭ થી અત્રેના ખાતામાં તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ મળેલ પ્રથમ અપીલ અરજીના અનુસંધાને ઈ.ચા.મુખ્ય હિસાબનીશ અને અપીલ અધિકારીશ્રી, હિસાબી વિભાગ તરફથી અરજદારશ્રીને સંદર્ભ–૦૮ થી તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૫:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન મુખ્ય હિસાબી ખાતામાં રૂબરૂ હાજર રહેવા બોલાવેલ. સદર તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ થયેલ રૂબરૂ સુનાવણીમાં જાહેર માહિતી અધિકારી અને ડે.એકાઉન્ટન્ટશ્રી તેમજ અરજદારશ્રી હાજર રહ્યા હતા. સદર સુનાવણી દરમ્યાન ધી જી.પી.એમ.સી.એક્ટની

કલમ ૬૩/૨ મુજબની અરજદારશ્રી ધ્વારા માંગવામાં આવેલ માહિતી બાબતે તથા સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર આર.ટી.આઈ. અન્વયેના પ્રોઓક્ટીવ ડિસ્કલોઝરની માહિતી બાબતે રૂબરૂમાં પૂરતી સમજણ આપેલ હોય, અરજદારશ્રીને પાઠવવામાં આવેલ માહિતીથી અને આપેલ સમજણથી અરજદારશ્રી સંતુષ્ટ હોય, તેઓની અપીલ અરજી દફ્તરે કરવા યોગ્ય હુકમ થવા વિનંતી.

:: હુકમ ::

અરજદારની મૂળ અરજી, અપીલ અરજી તેમજ ઉપલબ્ધ હકીકતો ધ્વારે લેતાં નીચે મુજબનો હુકમ કરી અપીલનો નિકાલ કરવામાં આવેલ છે.

"અરજદારશ્રીની આઈ.ડી.નં. ઉ ૧૦૨, તા. ૨૮/૦૨/૨૦૨૪ ની અરજી તેમજ તા. ૦૩/૦૫/૨૦૨૪ ની અપીલ અરજીથી માંગવામાં આવેલ માહિતી અત્રેના ઉપલબ્ધ રેકર્ડ મુજબ (પાના નંંગ-૫૧) તા. ૧૬/૦૪/૨૦૨૪ ના રોજ અરજદારશ્રીને પાઠવવામાં આવેલ છે અને તે બાબતે ઉક્ત નિર્દિષ્ટ સુનાવણીમાં થયેલ ચર્ચા મુજબ અરજદારશ્રીને પાઠવવામાં આવેલ માહિતી તેમજ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર આર.ટી.આઈ. અન્વયેના પ્રોઓક્ટીવ ડિસ્કલોઝરની માહિતી બાબતે આપેલ સમજણથી અરજદારશ્રી સંપૂર્ણ સંતુષ્ટ છે, જેથી અરજદારશ્રીને અન્ય કોઈ માહિતી આપવાની રહેતી ન હોય, તેઓની સદર અપીલ અરજી દફ્તરે કરવા જાહેર માહિતી અધિકારી અને ડે.એકાઉન્ટન્ટશ્રીને જણાવવામાં આવે છે."

અરજદાર સદર હુકમથી નારાજ હોય તો ગુજરાત માહિતી આયોગ, કર્મયોગી ભવન, રાજ્ય કક્ષાની કચેરીઓ, બ્લોક નં. ૧, બીજો માળ, નિર્માણ ભવન પાછળ, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર ખાતે બીજી અપીલ કરી શકે છે.

નં. એકા/આર.ટી.આઈ./
તા. /૦૫/૨૦૨૪

(બી.બી.મોટી)
ઇ.ચા.મુખ્ય હિસાબનીશ અને
અપીલ અધિકારી,
મુખ્ય હિસાબી વિભાગ,
સુરત મહાનગરપાલિકા

ન.રવાના: (૦૧) જાહેર માહિતી અધિકારી અને ડે.એકાઉન્ટન્ટશ્રી પ્રતિ....જાણ માટે.

(૦૨) શ્રી અજીત આર.માલપાની પ્રતિ....તેઓની અપીલ અરજી અંગે ઉપરની વિગતેના હુકમ ધ્વારા કરવામાં આવેલ નિકાલ સખબ જાણ સારુ.



બી.બી.મોટી
અપીલ અધિકારી અને
ઈ.ચા.મુખ્ય હિસાબનીશ



સુરત મહાનગર સેવાસદન
ગોરધનદાસ ચોખાવાલા માર્ગ,
મુગલીસરા, સુરત – ૩૮૪૦૦૩

આઈ.ડી. નંબર– ૨૨૪૮
કોમ્પ્યુટર અરજી ક્રમાંક નં. ૩૦૦/૬૧૬૮૧
અપીલ અરજી ક્રમાંક: ૨૦૨૪૩૦૦૦૬૯૩

અરજદાર : શ્રી રાકેશ એન.મોટી
સામાવાળા : જાહેર માહિતી અધિકારી અને ડ.એકાઉન્ટન્ટશ્રી (જે.એન.પટેલ),
હિસાબી વિભાગ, સુરત મહાનગરપાલિકા

ફરિયાદની હક્કિકત :–

વિષય :-	જાહેર માહિતી અધિકાર અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત માહિતી આપવા બાબત
સંદર્ભ :-	<p>૧) અરજદારશ્રીની આર.ટી.આઈ. એકટ હેઠળની તા.૦૨/૦૧/૨૦૨૫ ની અરજી આઈ.ડી. નંબર–૨૨૪૮</p> <p>૨) જાહેર માહિતી અધિકારી અને ડ.એકાઉન્ટન્ટશ્રી, હાઇડ્રોલિક વિભાગના પત્ર નં.એચઈડી/આઉટ/નં.૧૫૮, તા.૦૭/૦૧/૨૦૨૫ થી તબદીલ થયેલ અરજી અત્રેના હિસાબી ખાતાના ઈનવર્ડ નં.એકા/એસ.આર/ઈન/૭૨, તા.૦૮/૦૧/૨૦૨૫ થી હિસાબી ખાતામાં મળેલ છે.</p> <p>૩) અત્રેના પત્ર નં.એકા/આર.ટી.આઈ./૬૧, તા.૧૭/૦૧/૨૦૨૫</p> <p>૪) રસીદ નં.૩૦૦/૩૪, તા.૨૧/૦૧/૨૦૨૫, રૂ.૧૪/- નાણાં જમા કરાવ્યેથી તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ પાના નંગ–૭ પાઠવવામાં આવેલ.</p> <p>૫) અરજદારશ્રીની આર.ટી.આઈ. એકટ હેઠળની તા.૨૩/૦૧/૨૦૨૫ ની અપીલ અરજી</p> <p>૬) અપીલ અરજી અત્રેના હિસાબી ખાતા નં.એકા/એસ.આર/ઈન/૮૦, તા.૨૩/૦૧/૨૦૨૫ થી હિસાબી ખાતામાં મળેલ છે.</p> <p>૭) અત્રેના પત્ર નં.એકા/આર.ટી.આઈ/૭૬, તા.૦૬/૦૨/૨૦૨૫</p> <p>૮) અપીલની રૂબરૂ સુનાવણી તા.૧૧/૦૨/૨૦૨૫</p> <p>૯) અરજદારશ્રીના તરફથી મળેલ પત્ર તા.૧૧/૦૨/૨૦૨૫ કે જે અત્રેના ખાતામાં તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ ઈનવર્ડ કરેલ છે.</p>

અરજદારશ્રી રાકેશ એન.મોટીની આઈ.ડી.નં.૨૨૪૮, તા.૨૩/૦૧/૨૦૨૫ ની પ્રથમ અપીલ અરજીથી "માંગયા મુજબની માહિતી અધુરી / મીસ લીડિંગ કરનારી આપવામાં આવે છે" એવું જણાવી એપેલેટ ઓફિસરશ્રી, હિસાબી વિભાગને તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ પ્રથમ અપીલ કરવામાં આવેલ છે, જે પ્રથમ અપીલ અરજી અત્રેના વિભાગમાં સંદર્ભ–૬ થી તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ મળેલ છે.

અરજદારની આઈ.ડી.નં.૨૨૪૮ તા.૦૨/૦૧/૨૦૨૫ ની અરજીથી માહિતી માંગતી અરજી ઉક્ત સંદર્ભ–૦૨ મુજબના પત્રથી અતે હિસાબી વિભાગને તબદીલ કરવામાં આવેલ, જેના અનુસંધાને જાહેર માહિતી અધિકારી અને ડ.એકાઉન્ટન્ટશ્રી તરફથી "સદર અરજી અન્વયે માંગવામાં આવેલ માહિતીના પાના નંગ–૭ ના રૂ.૨/- લેખે રૂ.૧૪/-અરજદારશ્રી ધ્વારા જમા કરાવ્યેથી તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ સદર માહિતી રૂબરૂમાં પાઠવવામાં આવેલ."

ત્યારબાદ ઉક્ત સંદર્ભ–૬ થી અત્રેના ખાતામાં તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ મળેલ પ્રથમ અપીલ અરજીના અનુસંધાને ઈ.ચા.મુખ્ય હિસાબનીશ અને અપીલ અધિકારીશ્રી, હિસાબી વિભાગ તરફથી અરજદારશ્રીને સંદર્ભ–૭ થી તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૩૦ કલાકથી ૫:૩૦ કલાકના સમયગાળા દરમ્યાન મુખ્ય હિસાબી ખાતામાં રૂબરૂ હાજર રહેવા બોલાવેલ. સદર તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ થયેલ રૂબરૂ સુનાવણીમાં જાહેર માહિતી અધિકારી

અને ડે.એકાઉન્ટન્ટશ્રી તેમજ અરજદારશ્રી હાજર રહ્યા હતા. સદર સુનાવણીમાં ચર્ચા દરમ્યાન અરજદારશ્રી ધ્વારા થયેલ રજૂઆતના સંદર્ભમાં માંગ્યા મુજબની માહિતીની પૂર્તતા નીચે જણાવ્યા મુજબ છે.

અ.નં.	માહિતીની વિગત
મુદ્રા નં. ૧	અરજદારની રજૂઆતના મુદ્રા નં. ૧ મુજબ ઈન્કમટેક્ષ રીબેટ મેળવવા માટે માંગેલ સમયગાળા બાબતે આપેલ ખરેખર રોકાણ વર્ષ ૨૦૨૪-૨૫ ની માહિતી હિસાબી વિભાગના પરિપત્ર નં.એકા./સી.આઈ.આર./૨૪, તા. ૧૭/૧૨/૨૦૨૪ ના મુદ્રા નં.(૫) માં (અ), (બ), (ક) માં સ્પષ્ટ જણાવેલ છે.
મુદ્રા નં.૨	અરજદારની રજૂઆતના મુદ્રા નં.૨ અન્વયે સુરત મહાનગરપાલિકાના પરિપત્ર નં.એકા./સી.આઈ.આર./૧૩, તા.૦૫/૦૩/૨૦૨૪ મુજબ ડિસેમ્બર-૨૦૨૪ સુધી પ્રપોર્ડ રોકાણ ધ્યાનમાં લઈ TDS ની કપાત કરવામાં આવે છે તેમજ જાન્યુઆરી-૨૫ તથા ફેબ્રુઆરી-૨૫ માસ માટે ખરેખર રોકાણ (પરિપત્ર નં.એકા./સી.આઈ.આર./૨૪, તા. ૧૭/૧૨/૨૦૨૪ મુજબ) ધ્યાનમાં લેવામાં આવે છે. વધુમાં, સુરત મહાનગરપાલિકા માં નાણાંકીય વર્ષ માર્ય પેઈડ ઈન એપ્રિલથી ફેબ્રુઆરી પેઈડ ઈન માર્યને ધ્યાનમાં લેવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રી નટવરલાલ વેપારી એન્ડ કું. ના અભિપ્રાય મુજબ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માર્ય માસ દરમ્યાન કરવામાં આવેલ રોકાણોને પોતાના ઈન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરતાં સમયે બાદ લઈ શકે છે.
મુદ્રા નં.૩	મુદ્રા નં.૩ મુજબ આપેલ ઈન્કમટેક્ષ બાબતની માહિતીની નકલ પાના નં.૧ થી ૮ (ઓનલાઈન ડાઉનલોડ કરેલ નકલ) ને ઓથેન્ટીક ગણી શકાય નહિ.
મુદ્રા નં.૪	મુદ્રા નં.૪ માં માંગ્યા મુજબની માહિતી અરજદારને અત્રેના ઉપલબ્ધ રેકર્ડ મુજબ કુલ પાના નંગ-૧૫ વિનામૂલ્યે પાઠવવાના રહે છે.

ઉપરોક્ત જણાવેલ વિગતો ધ્યાને લઈ અરજદારશ્રીને અન્ય કોઈ માહિતી હવે આપવાની રહેતી ન હોય, તેઓની અપીલ અરજી દફતરે કરવા યોગ્ય હુકમ થવા વિનંતી.

ઃ હુકમ ૻ:

અરજદારની મૂળ અરજી, અપીલ અરજી તેમજ ઉપલબ્ધ હકીકતો ધ્યાને લેતાં નીચે મુજબનો હુકમ કરી અપીલનો નિકાલ કરવામાં આવેલ છે.

"અરજદારશ્રીની આઈ.ડી.નં.૨૨૪૮, તા.૦૨/૦૧/૨૦૨૫ ની અરજી તેમજ તા.૨૩/૦૧/૨૦૨૫ ની અપીલ અરજીથી માંગવામાં આવેલ માહિતી અત્રેના ઉપલબ્ધ રેકર્ડ મુજબ (પાના નંગ-૭) તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ અરજદારશ્રીને પાઠવવામાં આવેલ છે અને તે બાબતે ઉક્ત નિર્દિષ્ટ સુનાવણીમાં થયેલ ચર્ચા મુજબ માંગ્યા મુજબની માહિતીના મુદ્રાઓની પૂર્તતા કરવામાં આવેલ અને મુદ્રા નં.૪ ની માહિતીના પાના નંગ-૧૫ વિનામૂલ્યે પાઠવવા તેમજ અરજદારશ્રીને હવે અન્ય કોઈ માહિતી આપવાની રહેતી ન હોય, તેઓની સદર અપીલ અરજી દફતરે કરવા જાહેર માહિતી અધિકારી અને ડે.એકાઉન્ટન્ટશ્રીને જણાવવામાં આવે છે."

અરજદાર સદર હુકમથી નારાજ હોય તો ગુજરાત માહિતી આયોગ, કર્મયોગી ભવન, રાજ્ય કક્ષાની કચેરીઓ, બ્લોક નં.૧, બીજો માળ, નિર્માણ ભવન પાછળ, સેક્ટર નં.૧૦-એ, ગાંધીનગર ખાતે બીજી અપીલ કરી શકે છે.

નં.એકા/આર.ટી.આઈ./
તા. /૦૨/૨૦૨૫

(બી.બી.મોટી)
ઈ.ચા.મુખ્ય હિસાબનીશ અને
અપીલ અધિકારી,
મુખ્ય હિસાબી વિભાગ,
સુરત મહાનગરપાલિકા

ન.રવાના: (૦૧) જાહેર માહિતી અધિકારી અને ડે.એકાઉન્ટન્ટશ્રી પ્રતિ....જાણ માટે.

(૦૨) શ્રી રાકેશ એન.મોદી પ્રતિ....તેઓની અપીલ અરજી અંગે ઉપરની વિગતેના હુકમ ધ્વારા
કરવામાં આવેલ નિકાલ સબ્બ જાણ સારુ.